

હું/અમે નીચે ટીક કરેલ (✓) અંતિમ વપરાશ માટે બિઝનેસ લોનની અરજી કરવા ઈચ્છું છું/ઈચ્છીએ છીએ અને મારા/અમારા દ્વારા ફોર્મમાં પૂરી પાડવામાં આવેલ વિગતો અનુસાર લોન અરજીને પ્રોસેસ કરવાની વિનંતી કરું છું/કરીએ છીએ.

☐ વેપાર વિસ્તરણ ☐ કાર્યકારી મૂડી ☐ પ્લાન્ટ અને મશીનરીની ખરીદી ☐ અન્ય (કૃપા કરીને નિયત કરો) વર્ગ: ☐ શિશુ ☐ કિશોર ☐ તરુણ

લોનની વિગતો લોનનો પ્રકાર: ☐ ટર્મ લોન ☐ ઓવરડ્રાફ્ટ સુવિધા અવધિ (મહિનાઓ) ☐ 12 ☐ 24 ☐ 36 ☐ 48 લોનની રકમ રૂ

આ સુવિધાની આવકનો ઉપયોગ નાની બચત યોજનાઓ, કેપિટલ માર્કેટ, પ્રાઈમરી ગોલ્ડ, ગોલ્ડ બુલિયન, સોનાના ઘરેણાં, ગોલ્ડ ઈટીએફ્ડના એકમો અથવા મ્યુચ્યુઅલ ફંડ સહિત કોઈપણ સ્વરૂપે સોનું ખરીદવા માટે કરવામાં આવશે નહીં. મારા/અમારા દ્વારા મંજૂર કરવામાં આવે છે કે હું/અમે કથિત કેડિટ સુવિધાનો ઉપયોગ ઉપર દર્શાવેલ વેપારના હેતુ માટે જ કરીશ/કરીશું.

બિન-વ્યક્તિગત અરજદારની વિગતો (જો લાગુ હોય તો)

એકમનું નામ

સંસ્થાપનની તારીખ વેપારમાં ગાળેલા વર્ષોની સંખ્યા પાન/જીઆઈઆર નં. જીએસટી નં.

ઉદ્યોગનો પ્રકાર ☐ ઉત્પાદન ☐ ટ્રેડિંગ ☐ સેવા(સર્વિસ) ☐ અન્ય (કૃપા કરીને નિયત કરો) રચના ☐ ભાગીદારી ☐ પ્રાઇવેટ લિમિટેડ ☐ એકલ માલિકી ☐ અન્ય (કૃપા કરીને નિયત કરો)

ઝેડઈડી ગ્રેડેશન: 1. શું અરજદાર ઝેડઈડી રેટેડ છે (હા / ના) સીઆઈએન
2. જો હા હોય તો, અરજદાર એકમ દ્વારા મેળવવામાં આવેલ ગ્રેડેશન(યોગ્ય પર ટીક કરો) એલઈઆઈ
☐ બ્રોન્ઝ ☐ સિલ્વર ☐ ગોલ્ડ ☐ ડાયમંડ ☐ પ્લેટિનમ

☐ એફએટીસીએ-સીઆરએસ ઘોષણા (લાગુપાત્ર હોય તો ટીક કરો) : ભારત બહાર ન્યાયક્ષેત્ર(ન્યાયક્ષેત્રો)માં ટેક્સના હેતુ માટે ઘર
કૃપા કરીને નોંધો કે જો ઉપરોક્ત ચેક બોક્સમાં ટીક કરવામાં આવી હોય તો, સંપૂર્ણ રીતે ભરેલી અને સહી કરેલી એફએટીસીએ-સીઆરએસ ઘોષણાની નકલ એકમ ફોર્મ માટે લોન અરજી સાથે જમા કરો.

એકમનું નોંધાયેલ સરનામું ☐ પસંદગીનું મેઈલિંગ સરનામું વર્તમાન સરનામા પર વર્ષો/મહિનાઓ શહેરમાં વર્ષો

સરનામું

સીમાચિહ્ન શહેર

રાજ્ય પિનકોડ સંપર્ક વિગતો એસટીડી કોડ ફોન નં.

મોબાઈલ ઈ-મેઈલ આઈડી

વેપારનું સ્થળ ☐ સ્વ-માલિકીનું અને ભારણ વગરનું ☐ સ્વ-માલિકીનું અને ભારણ સાથે ☐ ભાડાનું અંતર્ગત વેપાર માટે (વર્ષોની સંખ્યા)

એકમનું કાર્યકારી સરનામું ☐ પસંદગીનું મેઈલિંગ સરનામું ☐ નોંધાયેલ સરનામાની માફક વર્તમાન સરનામે ગાળેલા વર્ષો/મહિનાઓ શહેરમાં વર્ષો

સરનામું

સીમાચિહ્ન શહેર

રાજ્ય પિનકોડ સંપર્ક વિગતો એસટીડી કોડ ફોન નં.

મોબાઈલ ઈ-મેઈલ આઈડી

વેપારનું સ્થળ ☐ સ્વ-માલિકીનું અને ભારણ વગરનું ☐ સ્વ-માલિકીનું અને ભારણ સાથે ☐ ભાડાનું અંતર્ગત વેપાર માટે (વર્ષોની સંખ્યા)

સંપર્ક વ્યક્તિની વિગતો સંબોધન ☐ શ્રી. ☐ કુ. ☐ મિક્સ ☐ ડૉ. ☐ અન્ય (કૃપા કરીને નિયત કરો) અન્યમાં સામેલ છે (એડવોકેટ, બ્રિગેડિયર, કેપ્ટન, કમાન્ડર, મેજર, પ્રોફેસર, ચીફ જસ્ટીસ, મેજર જનરલ, કર્નલ, માસ્ટર) હોલો

પૂરું નામ

દેશનો કોડ એસટીડી કોડ ફોન નં. મોબાઈલ

ઈ-મેઈલ આઈડી (અધિકૃત)

બેંક/નાણાંકીય સંસ્થાનો પાસેથી લેવામાં આવેલ કેડિટ સુવિધાની વિગતો(આરબીએલ બેંક સહિત)

રકમ રૂ. લાખમાં

બેંકનું નામ / નાણાંકીય સંસ્થાન	સુવિધાનો પ્રકાર	મંજૂર રકમ	વર્તમાન બાકી લેણાં	વ્યાજનો દર અને અવધિ

એસોસિએટ/જૂથ એકમોની વિગતો

રકમ રૂ. લાખમાં

એકમનું નામ	વ્યવસાયનો પ્રકાર	યોજનું વેચાણ	યોજનો નફો	યોજની આવક

અરજદારની નાણાંકીય વિગતો

રકમ રૂ. લાખમાં

આવશ્યક	(નાણાંકીય વર્ષ_____)	(નાણાંકીય વર્ષ_____)	(નાણાંકીય વર્ષ_____)	આવશ્યક	(નાણાંકીય વર્ષ_____)	(નાણાંકીય વર્ષ_____)	(નાણાંકીય વર્ષ_____)
યોજનું વેચાણ				ટેક્સ બાદ યોજનો નફો			
કાર્યકારી નફો				યોજની આવક			

અરજદારના પ્રાથમિક બેંક ખાતાની વિગતો

અરજદારના સેકન્ડરી બેંક ખાતાની વિગતો

બેંકનું નામ:	
શાખા	
બેંક ખાતા નં.:	
ખાતાનો પ્રકાર:	☐ વર્તમાન ☐ બચત ☐ ઓડી/સીસી ખાતું ખોલ્યાનું વર્ષ:
ઓડી/સીસી મર્યાદા:	

બેંકનું નામ:	
શાખા	
બેંક ખાતા નં.:	
ખાતાનો પ્રકાર:	☐ વર્તમાન ☐ બચત ☐ ઓડી/સીસી ખાતું ખોલ્યાનું વર્ષ:
ઓડી/સીસી મર્યાદા:	

સ્વ-રોજગાર વ્યક્તિગત/વ્યવસાયી અથવા માલિક લોનની વિગતો

રકમ રૂ. લાખમાં

પ્રમોટર/ભાગીદારનું નામ	લોનનો પ્રકાર	ક્યાંથી લેવામાં આવી	મંજૂર રકમ	વર્તમાન લેણાં

1 ટ્રેડ સંદર્ભ

એકમનું નામ _____

સંપર્ક વ્યક્તિ _____

અરજદાર સાથે સંબંધ: ☐ સપ્લાયર ☐ ગ્રાહક ☐ પ્રતિસ્પર્ધી ☐ અન્ય (કૃપા કરીને નિયત કરો)

સરનામું: _____

_____ પિન કોડ _____

સંપર્ક નં.: _____

ઈ-મેઇલ આઇડી: _____

2 ટ્રેડ સંદર્ભ

એકમનું નામ _____

સંપર્ક વ્યક્તિ _____

અરજદાર સાથે સંબંધ: ☐ સપ્લાયર ☐ ગ્રાહક ☐ પ્રતિસ્પર્ધી ☐ અન્ય (કૃપા કરીને નિયત કરો)

સરનામું: _____

_____ પિન કોડ _____

સંપર્ક નં.: _____

ઈ-મેઇલ આઇડી: _____

પીએસએલ વર્ગ: પ્રાયોરિટી સેક્ટર /એમએસએમઇ શ્રેણી

☐ પ્રત્યક્ષ કૃષિ ☐ ખાદી અને ગ્રામોદ્યોગ (કેવીઆઈ ક્ષેત્ર) ☐ લઘુ ઉત્પાદન સાહસ ☐ સૂક્ષ્મ સેવા સાહસ ☐ મધ્યમ સેવા સાહસ

☐ પરોક્ષ કૃષિ ☐ સૂક્ષ્મ ઉત્પાદન સાહસ ☐ મધ્યમ ઉત્પાદન સાહસ ☐ લઘુ સેવા સાહસ ☐ શૈક્ષણિક

લોન અરજી માટે દસ્તાવેજો પર સ્વ-પ્રમાણિતતા માટે અન્ડરટેકિંગ

ક્રમાંક નં.	દસ્તાવેજો	વિગતો	હા/ના
1	કંપની ફાયનાન્સિયલ્સ	વર્ષ 1 (એવાય) વર્ષ 2 (એવાય)	
	આ સમયગાળાની આઈટીઆર નકલો →		
	આ સમયગાળાના નાણાંકીય દસ્તાવેજો →		
વિવિધ ધિરાણદારો તરફથી લોનની વિગતો/મંજૂરી પત્ર			
2	ધિરાણદારનું નામ	લોનની સંખ્યા	
	એ		
	બી		
	સી		
3	ઓડી/સીસી મંજૂરી પત્ર		
4	વર્ષ(વર્ષો) _____ નું વીએટી/સીએસટી/એસટી/જીએસટી વળતર અને ચલાન વર્ષ _____		

અમારા ખાતાના બેંક સ્ટેટમેન્ટ્સ અને વિગતો નીચે આપેલ છે				
	બેંકનું નામ	ખાતું#	તારીખથી	તારીખ સુધી
5	એ			
	બી			
	સી			
	ડી			
	ઈ			
ઉપરોક્ત સિવાય અન્ય દસ્તાવેજોની યાદી				
6	એ			
	બી			
	સી			
	ડી			

ઘોષણા

- ☐ મારા/અમારા દ્વારા બેંકને સમયે સમયે મારા/અમારા ઘર/સંપર્ક જાણકારી/રોજગારમાં થતા બદલાવ વિશે અને આવા બદલાવના 30 દિવસની અંદર અપડેટ કરેલા દસ્તાવેજો પૂરા પાડવાની બાંધધરી આપવામાં આવે છે.
- મારા/અમારા દ્વારા ઘોષિત કરવામાં આવે છે કે અરજી ફોર્મમાં આપવામાં આવેલ તમામ વિગતો અને જાણકારી સાચી, ચોક્કસ અને સંપૂર્ણ છે અને આરબીએલ બેંક લિમિટેડ("આરબીએલ") સામે કોઈ જાણકારી રોકવામાં/દબાવવામાં આવી નથી. ("RBL").
 - મારા/અમારા દ્વારા આવશ્યક નાણાંકીય સહાય(સહાયો)ના સંદર્ભમાં જરૂર પડ્યા અનુસાર આવું અતિરિક્ત લખાણ મારા/અમારા દ્વારા આપવામાં આવશે. મારા/અમારા દ્વારા આરબીએલ બેંકને મારા વિશે કોઈપણ બેંક/વ્યક્તિ તરફથી સંદર્ભ તપાસવાની અધિકૃતતા આપવામાં આવે છે.
 - હું/અમે મારા/અમારા ઘર કે રોજગાર/વ્યવસાયના સરનામામાં કોઈ ફેરફાર અથવા મારી કેડિટ યોગ્યતાને અસર કરે તેવા કોઈપણ બદલાવ વિશે આરબીએલ બેંકને લેખિતમાં જાણ કરીશ/કરીશું. મારા/અમારા દ્વારા મંજૂર કરવામાં આવે છે કે સુવિધાની આવકનો ઉપયોગ કિસાન વિકાસ પત્ર(હેવીપી), કેપિટલ માર્કેટ સહિત નાની બચતના સાધનોના એક્વીઝિશન/રોકાણમાં, પ્રાથમિક ગોલ્ડ, ગોલ્ડ બુલિયન, સોનાના ધરેણાં, સોનાના સિક્કા, ગોલ્ડ ઈટીએફના એકમો અને મ્યુચ્યુઅલ ફંડ સહિત કોઈપણ સ્વરૂપે સોનું ખરીદવા માટે ઉપયોગમાં લેવામાં આવશે નહીં. મારા/અમારા દ્વારા મંજૂર કરવામાં આવે છે કે કશિત કેડિટ સુવિધાનો ઉપયોગ હું/અમે ઓઝોન ડિપ્લીટીંગ સબસ્ટેન્સીઝ(ઓડીસી)નો ઉપયોગ કરતાં/ઉત્પાદન કરતાં નવા એકમો/કલોરોફ્લુરોકાર્બોનસોનો ઉપયોગ કરતાં એરોસોલ એકમોના ઉત્પાદન માટે કરીશ/કરીશું નહીં. મારા/અમારા દ્વારા મંજૂર કરવામાં આવે છે કે ફંડનો ઉપયોગ દર્શાવેલ હેતુ માટે જ કરવામાં આવશે અને સફા અથવા અસામાજિક હેતુ માટે કરવામાં આવશે નહીં.
 - મારા/અમારા દ્વારા ઘોષણા કરવામાં અને મંજૂર કરવામાં આવે છે કે ચાલુ નાણાંકીય વર્ષમાં એકમનું ટર્નઓવર આ અરજીપત્રમાં બીડ્યા અનુસારનું છે અને હું/અમે રૂ. 50 કરોડથી ઉપર ટર્નઓવરના કોઈપણ વધારા માટે આરબીએલ બેંકને લેખિતમાં જણાવીશું. (વર્તમાન નાણાંકીય વર્ષમાં જો પહેલેથી જ રૂ. 50 કરોડની ઉપર ન ગયું હોય તો)
 - હું/અમે સમજું છું/સમજીએ છીએ કે આ અરજી સાથે જમા કરેલ ફોટોગ્રાફ અને દસ્તાવેજ પોતાની પાસે રાખવાનો અધિકાર ધરાવે છે અને તે મને/અમને પરત કરવામાં આવશે નહીં. હું/અમે સમજું છું/સમજીએ છીએ કે આ લોનની મંજૂરી આરબીએલ બેંકની મુનસફીને અને મારા/અમારા દ્વારા આરબીએલ બેંક દ્વારા જરૂરી આવશ્યક દસ્તાવેજો અને અન્ય ચૌપચારિકતા પૂરી કરવાને આધીન છે. મારા/અમારા દ્વારા આગળ મંજૂર કરવામાં આવે છે કે મારી/અમારી લોન સમયે સમયે અમલમાં આવતા આરબીએલ બેંકના નિયમો/નીતિઓ અને અન્ય કાનૂની અને નિયમનકારી માર્ગદર્શિકાઓ દ્વારા સંચાલિત છે.
 - વ્યક્તિગત માટે:
 - મારા/અમારા દ્વારા મંજૂર કરવામાં આવે છે કે હું/અમે આરબીએલ બેંકના ડિરેક્ટર નથી અથવા આરબીએલ બેંકના કોઈપણ ડિરેક્ટર/વરિષ્ઠ અધિકારીના નિર્દિષ્ટ નજીકના સ્વજન નથી(આરબીઆઈ દ્વારા નિયત કર્યા અનુસાર).
 - મારા/અમારા દ્વારા મંજૂર કરવામાં આવે છે કે હું/અમે અન્ય બેંકના ડિરેક્ટર/વરિષ્ઠ અધિકારી નથી અથવા અન્ય બેંકના કોઈ ડિરેક્ટરના નિર્દિષ્ટ નજીકના સ્વજન(આરબીઆઈ દ્વારા નિયત કર્યા અનુસાર) નથી. હું/અમે રાજનૈતિક રીતે ખુલ્લી પડેલ વ્યક્તિ નથી/રાજનૈતિક રીતે ખુલ્લી પડેલ વ્યક્તિના સ્વજન નથી (સમયે સમયે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા વ્યાખ્યાયિત અને સુધાર્યા અનુસાર).
 - કોર્પોરેટ/પેઢીઓ/ટ્રસ્ટ માટે:
 - અમે મંજૂર કરીએ છીએ કે આરબીએલ બેંકના કોઈપણ ડિરેક્ટર લેણદારના અથવા લેણદારની સબસિડીઅરીના અથવા હોલ્ડિંગ કંપનીના ડિરેક્ટર, મેનેજર, મેનેજીંગ એજન્ટ, કર્મચારી અથવા ગેરંટર નથી, અથવા લેણદારમાં અથવા લેણદારની સબસિડીઅરી અથવા હોલ્ડિંગ કંપનીના નોંધપાત્ર હિત ધરાવતા નથી અને કોઈપણ અન્ય બેંકના ડિરેક્ટર* લેણદારના ડિરેક્ટર અથવા ગેરંટર તરીકે નોંધપાત્ર હિત ધરાવતા નથી કે ઇચ્છુક નથી. હું/અમે રાજનૈતિક રીતે ખુલ્લી પડેલ વ્યક્તિ નથી/રાજનૈતિક રીતે ખુલ્લી પડેલ વ્યક્તિના સ્વજન નથી (સમયે સમયે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા વ્યાખ્યાયિત અને સુધાર્યા અનુસાર).
 - *તેમને શેડ્યુલ્ડ કો-ઓપરેટીવ બેંકના ડિરેક્ટર, તેમના સ્વજનો, સબસિડીઅરીના ડિરેક્ટર/ મ્યુચ્યુઅલ ફંડના ટ્રસ્ટીઓ/ ધિરાણ કરનાર બેંક અથવા અન્ય બેંક દ્વારા સ્થાપિત વેન્ચર કેપિટલ ફંડનો સમાવેશ થાય છે. જો ઉપરોક્ત ઘોષણા ખોટી માલુમ પડે તો, બેંકને સુવિધા રદ કરવાનો અને/અથવા પાછી માંગવાનો અધિકાર છે.
 - અમારા દ્વારા મંજૂર કરવામાં આવે છે કે નિયમનકારી માળખાના ડિરેક્ટર/ભાગીદાર/સભ્યો/લેણદારના ગેરંટર અથવા આવા ડિરેક્ટર/ભાગીદાર/નિયમનકારી માળખાના /લેણદારના ડિરેક્ટરના નિર્દિષ્ટ સ્વજનો કોઈપણ બેંકિંગ કંપનીના ડિરેક્ટર નથી.
 - અમારા દ્વારા મંજૂર કરવામાં આવે છે કે ચેરમેન/મેનેજીંગ ડિરેક્ટરના કોઈ સ્વજન(આરબીઆઈ દ્વારા નિયત કર્યા અનુસાર) અથવા બેંકના ડિરેક્ટર અથવા વરિષ્ઠ અધિકારીના સ્વજન(આરબીઆઈ દ્વારા નિયત કર્યા અનુસાર) નોંધપાત્ર હિત ધરાવતા નથી અથવા લેણદાર(લેણદારો)ની (કોઈપણ) ના ડિરેક્ટર અથવા ગેરંટર તરીકે રસ ધરાવતા નથી.
 - મારા/અમારા આરબીએલ બેંકને અધિકૃત કરવામાં આવે છે અને સંમતિ આપવામાં આવે છે કે મને/અમને નોટિસ આપ્યા વગર, આરબીએલ બેંક તરફથી લેવામાં આવેલી સુવિધાના સંબંધમાં અરજી ફોર્મ(ફોર્મ્સ)/સંબંધિત દસ્તાવેજોમાં મારા/અમારા દ્વારા આપેલી જાણકારી આરબીએલ બેંકની અન્ય શાખાઓ/સબસિડીઅરી/સંલગ્ન સંસ્થાઓ, કેડિટ બ્યુરો/રેટિંગ એજન્સીઓ, સર્વિસ પ્રોવાઇડર્સ, બેંકનાણાંકીય સંસ્થાઓ, સરકારી/નિયમનકારી સત્તાઓ અથવા ત્રીજા પક્ષ સમક્ષ કેવાયસી જાણકારી ખરાઈ, કેડિટ રિસ્ક એનાલિસીસ અથવા આરબીએલ બેંકને યોગ્ય લાગે તે અન્ય હેતુઓ માટે પ્રકટ કરી શકે છે.

- મારા/અમારા દ્વારા સમજવામાં અને સ્વીકૃત કરવામાં આવે છે કે આરબીએલ બેંક, કોઈપણ કારણ આપ્યા વગર (કાયદા દ્વારા જરૂરી હોય તે સિવાય), મારી/અમારી અરજી નામંજૂર કરવાની સંપૂર્ણ મુનસફી છે અને આવી નામંજૂરી અથવા આવી નામંજૂરી વિશે મને/અમને જાણ કરવામાં થયેલ વિલંબ, કોઈ ભરૂં, નુકસાન, ક્ષતિ અથવા ક્ષિત અથવા આવી નામંજૂરીને કારણે થયેલ અન્ય પરિણામ, અથવા મારી/અમારી અરજીના આવી નામંજૂરી વિશે મને/અમને જણાવવામાં થયેલ કોઈ વિલંબ માટે કોઈપણ રીતે જવાબદાર ગણાશે નહીં.
- મારા/અમારા દ્વારા સમજવામાં આવે છે કે લોનની અવધિ/પુનઃચૂકવણી/વ્યાજ/અન્ય નિયમો અને શરતો નાણાં બજારની સ્થિતિમાં કોઈ બદલાવના પરિણામરૂપે અથવા કોઈ વૈધાનિક કે નિયમનકારી જરૂરીયાતના કારણે અથવા બેંકની મુનસફી અનુસાર બદલાવને આધીન છે. આવી સ્થિતિમાં બેંક તેને યોગ્ય લાગે તે અનુસાર શરતોનું મૂલ્યાંકન કરવાનો અને સુધારવાનો અધિકાર ધરાવે છે.
- મારા/અમારા દ્વારા સમજવામાં આવ્યું છે કે વીમા ઉત્પાદનની ખરીદી સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે, અને તે બેંકની અન્ય કોઈ સુવિધાની ઉપલબ્ધિ સાથે સંકળાયેલ નથી.
- મારા/અમારા દ્વારા એ પણ મંજૂર કરવામાં આવે છે કે બેંક અથવા તેના કોઈપણ પ્રતિનિધિ દ્વારા લોનના પ્રમાણ/મંજૂરી પ્રક્રિયાના સંબંધમાં કોઈ વચન આપવામાં આવ્યું નથી અથવા કોઈ વિચલન/માફીનું વચન આપવામાં આવ્યું નથી. આ ઉપરાંત, અમારા દ્વારા આ લોન અરજીની સાથે કે તેના સંબંધમાં આરબીએલ બેંકના કોઈ પ્રતિનિધિ (અથવા) કોઈ ત્રીજા પક્ષને રોકડમાં, બેરર ચેક અથવા અન્ય કોઈ રીતે કોઈ ચૂકવણી કરવામાં આવી નથી.
- મારા/અમારા દ્વારા માર્કેટિંગ હેતુ માટે જાણકારી/સેવા વગેરે પ્રાપ્ત કરવાની મંજૂરી આપવામાં આવી છે/આપવામાં આવી નથી.

એ) 'રીટેલ લોન્સ એપ્લિકેશન ફોર્મ' માટે પ્રમાણભૂત ઘોષણા'માં ઉમેરો

- હું/અમે પ્રમાણિત કરું છું/પ્રમાણિત કરીએ છીએ કે આ અરજીમાં મારા/અમારા દ્વારા આપવામાં આવેલી જાણકારી તમામ રીતે સત્ય, સાચી અને સંપૂર્ણ છે અને આરબીએલ બેંક/બેંક(બેંક) સામે કોઈ મટિરીયલ જાણકારી રોકવામાં/દબાવવામાં નથી આવી. હું/અમે મંજૂર કરું છું/કરીએ છીએ કે સીધા જ અથવા કોઈ થર્ડ પાર્ટી એજન્ટ દ્વારા બેંક આ ખરાઈ કરાવવાનો અધિકાર ધરાવે છે. હું/અમે મંજૂર કરું છું/કરીએ છીએ કે નાણાંકીય/બેંક સ્ટેટમેન્ટ/ટાઈટલ/કાનૂની દસ્તાવેજો વગેરેની નકલો મારા/અમારા દ્વારા મારી/અમારી લોનની અરજી સામે જમા કરાવવામાં આવ્યા છે અને તે સાચી નકલો હોવાનું પ્રમાણિત કરું છું/કરીએ છીએ. આ સાથે હું/અમે આ સંબંધમાં કોઈપણ અન્ય સ્ત્રોત પાસેથી કોઈપણ જાણકારી મેળવવાના બેંકના અધિકારને સ્વીકારું છું/સ્વીકારીએ છીએ.
- મારા/અમારા દ્વારા સમજવામાં આવ્યું છે કે ઉપરોક્ત જાણકારી બેંક દ્વારા તેમની સંપૂર્ણ મુનસફી અનુસાર મળનાર કોઈપણ સુવિધાનો આધાર નક્કી કરે છે. મારા/અમારા દ્વારા આગળ મંજૂર કરવામાં આવે છે કે મળવાપાત્ર કોઈપણ સુવિધા સમયાંતરે અમલમાં હોય તેવા બેંકના નિયમો દ્વારા સંચાલિત રહેશે. હું/અમે મને/અમને મળનારી સુવિધા(ઓ)ના નિયમો અને શરતોને બંધનકર્તા છું/છીએ. મારા/અમારા દ્વારા લાગુપાત્ર કોઈપણ ફી, ચાર્જ, વ્યાજ વગેરે માટે મારા લોન ખાતામાંથી બેંકને ડેબિટ કરવાની અધિકૃતતા આપવામાં આવે છે.
- હું/અમે મારા/અમારા ધર કે વ્યવસાયના સરનામામાં કોઈ ફેરફાર અથવા મારી કેડિટ યોગ્યતાને અસર કરે તેવા કોઈપણ બદલાવ વિશે આરબીએલ બેંકને લેખિતમાં જાણ કરીશ/કરીશું.
- હું/અમે સમજું છું/સમજીએ છીએ કે આ અરજી સાથે જમા કરેલ કોટોગ્રાફ અને દસ્તાવેજ પોતાની પાસે રાખવાનો અધિકાર ધરાવે છે અને તે મને/અમને પરત કરવામાં આવશે નહીં.
- હું/અમે સમજું છું/સમજીએ છીએ કે આ લોનની મંજૂરી આરબીએલ બેંકની મુનસફીને અને મારા/અમારા દ્વારા આરબીએલ બેંક દ્વારા જરૂરી આવશ્યક દસ્તાવેજો અને અન્ય ચોપચારિકતા પૂરી કરવાને આધીન છે.
- મારા/અમારા દ્વારા સ્વીકાર અને મંજૂર કરવામાં આવે છે કે નીચેના માટે સેવાનો ઉપયોગ કરવામાં આવશે નહીં
 - કેપિટલ માર્કેટના સાધનોમાં રોકાણ કરવા માટે અથવા કોઈ સફા કે ગેરકાનૂની અથવા અસમાજિક હેતુઓ માટે અથવા ઓર્ગેન (ડિપ્લોમેન્ટ સબસ્ટેન્સીઝ/ઓડીએસ)નો ઉપયોગ કરતાં/ઉત્પાદન કરતાં નવા એકમો અથવા ક્ષેત્રોફરોકાર્બન્સ(સીએફસી)ના ઉપયોગમાં સંકળાયેલ એરોસોલ એકમોમાં
 - પ્રાથમિક ગોલ્ડ, ગોલ્ડ બુલિયન, સોનાના ધરણાં, સોનાના સિક્કા, ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડ ફંડ(ઈટીએફ)ના એકમો, ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડના એકમો, કિસાન વિકાસ પત્ર(કેવીસી) અને નેશનલ સર્વિસ સ્કીમ(એનએસસી) સહિત નાની બચતના સાધનો લેવાની સુવિધા માટે.
- હું/અમે કોઈ વૈધાનિક અથવા કાનૂની અસક્ષમતા ભોગવી નથી રહ્યો/નથી રહ્યા અને/અથવા કોઈ બંધનકર્તા એગ્રીમેન્ટમાં દાખલ થવાને અસક્ષમ છીએ. એ કિસ્સામાં જો દેણદાર કુદરતી વ્યક્તિ હોય, દેણદાર(દેણદારો) મેજર હોય, યોગ્ય મનોસ્થિતિ ધરાવતા હોય અને કરાર માટે સક્ષમ હોય.
- મારા/અમારા દ્વારા મંજૂર કરવામાં આવે છે કે અમારી સામે કોઈ નાદારી/સમાપન/વિદ્યુત કાર્યવાહી અથવા કોઈ ફોજદારી કાર્યવાહી શરૂ કરવામાં આવી નથી અથવા બાકી નથી અને કોઈ કોર્ટ, અથવા સત્તા દ્વારા અને નાદાર જાહેર કરવામાં આવ્યા નથી અથવા અમારી મિલકતો માટે કોઈ રીસીવર, એડમિનિસ્ટ્રેટર, ટ્રસ્ટી અથવા સમાન અધિકાર ધરાવતા અધિકારી નીમવામાં આવ્યા નથી.
- હું/અમે રાજનૈતિક રીતે ખુલ્લી પડેલ વ્યક્તિ નથી/રાજનૈતિક રીતે ખુલ્લી પડેલ વ્યક્તિના સ્વજન નથી (સમયે સમયે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા વ્યાખ્યાયિત અને સુધાર્યા અનુસાર)
- મારા/અમારા દ્વારા સમજવામાં આવે છે કે લોનની અવધિ/પુનઃચૂકવણી/વ્યાજ/અન્ય નિયમો અને શરતો નાણાં બજારની સ્થિતિમાં કોઈ બદલાવના પરિણામરૂપે અથવા કોઈ વૈધાનિક કે નિયમનકારી જરૂરીયાતના કારણે અથવા બેંકની મુનસફી અનુસાર બદલાવને આધીન છે. આરબીએલ બેંક તેમને યોગ્ય લાગે તે હદ સુધી લોનની શરતોનું પુનઃમૂલ્યાંકન અને સુધારણાનો હક ધરાવે છે.
- કંઈ બીજી જાણવા મળે તે સિવાય, હું/અમે કોઈ વર્તમાન ગ્રાહક આઈડી અથવા ઉપર જણાવ્યા સિવાયનું કોઈ બીજી ગ્રાહક આઈડી ધરાવતા નથી. મને/અમને આગોતરી નોટિસ પાઠવ્યા વગર, આરબીએલ બેંક તમામ ગ્રાહક આઈડીઓને એક ગ્રાહક આઈડીમાં સંઘટિત કરવાનો અધિકાર ધરાવે છે.
- મારા/અમારા દ્વારા સમજવામાં આવ્યું છે કે કેડિટનો નિર્ણય કેડિટના મોડેલ પર આધારીત છે જેમાં કેડિટ ઇતિહાસ, પુનઃચૂકવણી ટ્રેક રેકૉર્ડ, બેંકિંગની આદતો, વ્યવસાયિક સ્થિતિ અને રોકડ પ્રવાહ મૂલ્યાંકન વગેરે પરિબલોનો સમાવેશ થાય છે જેને વ્યક્તિગત ચર્ચા અને દસ્તાવેજીકરણના સંયોજનને આધારે ચકાસવામાં આવે છે.
- મારા/અમારા દ્વારા એ પણ મંજૂર કરવામાં આવે છે કે બેંક અથવા તેના કોઈપણ પ્રતિનિધિ દ્વારા લોનના પ્રમાણ/મંજૂરી પ્રક્રિયાના સંબંધમાં કોઈ વચન આપવામાં આવ્યું નથી અથવા કોઈ વિચલન/માફીનું વચન આપવામાં આવ્યું નથી. આ ઉપરાંત, અમારા દ્વારા આ લોન અરજીની સાથે કે તેના સંબંધમાં આરબીએલ બેંકના કોઈ પ્રતિનિધિ (અથવા) કોઈ ત્રીજા પક્ષને રોકડમાં, બેરર ચેક અથવા અન્ય કોઈ રીતે કોઈ ચૂકવણી કરવામાં આવી નથી.
- હું/અમે સમજું છું/સમજીએ છીએ કે પૂર્વશરત તરીકે, મને/અમને મંજૂર કરવામાં આવતી લોન/એડવાન્સીઝ/અન્ય નોન-ફંડ-આધારીત કેડિટ સુવિધાના સંબંધમાં, આરબીએલ બેંકને મને/અમને સંબંધિત જાણકારી અને ડેટાના, મારા/અમારા દ્વારા લેવાયેલ/લેવાનાર કેડિટ સુવિધાના, મારા/અમારા દ્વારા ધારણ કરાયેલ/ધારણ થનાર જવાબદારીઓ, તેના સંબંધમાં અને મારા/અમારા દ્વારા ડિફોલ્ટ, જો કોઈ હોય તો, તેના ડિસ્ચાર્જના પ્રગટીકરણ માટે મંજૂરીની જરૂર છે. તે જ રીતે, હું/અમે બેંક દ્વારા તમામ અથવા કોઈપણ (i) મારા/અમારા સંબંધિત જાણકારી અને ડેટાના; (ii) મારા/અમારા દ્વારા લેવાયેલ/લેનાર કોઈ કેડિટ સુવિધા સંબંધિત જાણકારી અથવા ડેટાના (iii) મારા/અમારા દ્વારા કરાયેલ ડિફોલ્ટ, જો કોઈ હોય તો, મારા/અમારી જવાબદારીઓની મુક્તિ માટે, બેંકને યોગ્ય અને જરૂરી લાગે તે રીતે, કેડિટ ઇન્ફોર્મેશન બ્યૂરો(ભારત) લિમિટેડ(સિબી) અને રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા/ભારત સરકાર અને સિબીલ દ્વારા આ માટે અધિકૃત કોઈ એજન્સી સામે પ્રગટીકરણની મંજૂરી અને સંમતિ આપું છું/આપીએ છીએ અને આવી કોઈપણ એજન્સી બેંક દ્વારા પ્રગટ કરેલ આવી જાણકારી અને ડેટાનો ઉપયોગ કે પ્રોસેસ કરી શકે છે, અને રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા વતી દ્વારા નિર્ધારિત કાર્ય અનુસાર સિબીલ અને અન્ય કોઈ અધિકૃત એજન્સી, પ્રોસેસ કરેલી જાણકારી અને ડેટા અથવા તેમના દ્વારા તે અનુસાર તૈયાર કરાયેલ ઉત્પાદન, વિચારણા માટે બેંક/નાણાંકીય સંસ્થા અને અન્ય કેડિટ આપનાર સમક્ષ, રજૂ કરી શકે છે.
- આ અરજી ફોર્મમાં દર્શાવ્યા અનુસાર મારા/અમારા દ્વારા મારી/અમારી અરજીની સ્થિતિ, ખાતાની હિલચાલ, સર્વિસ કોલ્સ(કલેક્શન્સ, એડવાઈઝરી અને શૈક્ષણિક/જાણકારી સંદેશા), નિયમનકારી અપડેટ્સ વિશે એસએમએસ ચેતવણીઓ/ફોન કોલ્સ તેમજ ઉત્પાદનના ઉપયોગ વિશે સંદેશા/કોલ્સ જે સમયે સમયે બેંક દ્વારા મારા/અમારા મોબાઈલ નંબર(નંબરો) પર મોકલવા/કરવામાં આવશે તેનો સ્વીકાર કરવાનું મંજૂર કરવામાં આવે છે.
- મારા/અમારા દ્વારા મંજૂર કરવામાં આવે છે કે મારા/અમારા દ્વારા સંમતિ આપવામાં આવી છે મે. _____, ને જે શ્રી/કુ _____ દ્વારા પ્રસ્તુત છે તેઓ _____ to લોનની ઉપલબ્ધિના હેતુ માટે મારી/અમારી સંપર્ક વિગતો બેંકને શેર/જમા કરી શકે છે.
- મારા/અમારા દ્વારા ઘોષણા કરવામાં અને મંજૂર કરવામાં આવે છે કે ચાલુ નાણાંકીય વર્ષમાં એકમનું ટર્નઓવર આ અરજીપત્રમાં બીડ્યા અનુસારનું છે અને હું/અમે રૂ. 50 કરોડથી ઉપર ટર્નઓવરના કોઈપણ વધારા માટે આરબીએલ બેંકને લેખિતમાં જણાવીશું. (વર્તમાન નાણાંકીય વર્ષમાં જો પહેલેથી જ રૂ. 50 કરોડની ઉપર ન ગયું હોય તો)

બી. કેવાયસી ખરાઈ

- આ સાથે મારા દ્વારા મારી પોતાની મુનસફી અનુસાર કેવાયસી હેતુઓથી ઓળખ/સરનામાનો પુરાવો સ્થાપિત કરવાના હેતુથી બાયોમેટ્રિક આધારીત ઈ-કેવાયસી અધિકૃતતા અથવા આરબીએલ બેંકને યુઆઈડીએઆઈ/આધાર) દ્વારા નિયત કરેલ ઓફલાઈન ખરાઈ માધ્યમો જમા કરાવવામાં આવે છે.
 - યુઆઈડીએઆઈમાંથી મારી વિગતોની ખરાઈ માટે આ સાથે હું આરબીએલ બેંકને મારો આધાર નંબર વાપરવાની અને/અથવા બાયોમેટ્રિક/ડેમોગ્રાફિક જાણકારીનો ઉપયોગ કરવાની અધિકૃતતા આપું છું. હું સમજું છું કે આરબીએલ બેંક યુઆઈડીએઆઈમાંથી ડેટા માટે મારો સંપર્ક કરશે અને મારા દ્વારા પસંદ કરાયેલ ઉત્પાદન/સેવાઓ પૂરી પાડવા માટે તેનો આરબીએલ બેંક દ્વારા સંગ્રહ કરવામાં આવશે.
 - આ સાથે હું એસએમએસ/ઈ-મેઈલ દ્વારા આરબીએલ બેંકને અરજી ફોર્મમાં મારા દ્વારા આપવામાં આવેલ નોંધાવેલ મોબાઈલ નંબર/ઈ-મેઈલ એડ્રેસ પર સીકેવાયસી રજીસ્ટ્રીમાંથી જાણકારી મેળવવાની સંમતિ આપું છું
- સી. ગ્રાહક સંમતિઓ**
- મારા/અમારા તરફથી કોઈપણ નિયત સંમતિ કે અધિકૃતતા વગર આરબીએલ બેંકની જૂથ કંપનીઓ/એસોસિયેટ્સ/પેટા કંપનીઓ/એફિલિયેટ્સ/સંયુક્ત જોડાણો અથવા બેંક દ્વારા આપવામાં આવતી કોઈપણ ઉત્પાદન/સેવાઓના માર્કેટિંગ/પ્રસ્તાવ/વેચાણ માટે 'સેવાઓ/ઉત્પાદનો'ની જોગવાઈ માટે બેંકે જેની સાથે જોડાણ કર્યું હોય/કરવા જઈ રહ્યા હોય તેવી વ્યક્તિને મારા (અમારા) દ્વારા/મારા(અમારા) સંબંધિત જાણકારી/ડેટા શેર કરવાની, પ્રેક્ટ કરવાની, એક્સચેન્જ કરવાની અથવા કોઈપણ રીતે ઉપયોગમાં લેવાની અધિકૃતતા હું/અમે બેંકને આપું છું/આપીએ છીએ.

☐ હા
 ☐ ના, મારી જાણકારી/ડેટા શેર કરવાની, પ્રેક્ટ કરવાની, એક્સચેન્જ કરવાની કે ઉપયોગમાં લેવાની મારા તરફથી સંમતિ નથી.
 - આરબીએલ બેંક, સ્વયં અને કોઈની સાથે જોડાણમાં અથવા ભાગીદારો/ત્રીજા પક્ષો દ્વારા આરબીએલ દ્વારા આપવામાં આવતા ઉત્પાદનો, સેવાઓ અને પ્રચાર ઓફર્સ માટે માર્કેટિંગ જાણકારી મોકલવા માટે/તમારો સંપર્ક કરવા માટે સમયે સમયે અરજીપત્રમાં તમે આપેલ વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરી શકે છે. નીચે તમારી પસંદગી દર્શાવીને તમે આરબીએલ બેંકને તમારો એસએમએસ, ફોન કોલ્સ કે ઈ-મેઈલ દ્વારા સંપર્ક કરવાની સંમતિ કે અસંમતિ આપી શકો છો:

☐ હા, બેંક મારો સંપર્ક કરી શકે છે
 ☐ ના, બેંક મારો સંપર્ક કરી શકતી નથી
 - સીકેવાયસી રજીસ્ટ્રી માટે આવશ્યક જાણકારી અપલોડ કરવાની હું/અમે સંમતિ આપું છું/આપીએ છીએ. મારી ઓળખ અને સરનામાની ખરાઈના હેતુથી સીકેવાયસી રજીસ્ટ્રીમાંથી મારા રેકૉર્ડ ડાઉનલોડ કરવાની અને સંગ્રહ કરવાની હું સંમતિ આપું છું. હું સમજું છું કે મારા કેવાયસી રેકૉર્ડમાં મારા કેવાયસી રેકૉર્ડ/અંગત જાણકારી જેવી કે મારું નામ, સરનામું, જન્મતારીખ, પાન નંબર વગેરેનો સમાવેશ થાય છે.

ડી. ઈન્થોરન્સ ઉત્પાદનો માટે સંમતિ:

એલએપી/માઈક્રો એલએપી/ડબલ્યૂસીએફ/એચએલ/એગ્રી માટે

જીવન વીમો: ☐ ઈચ્છુક ☐ ઈચ્છુક નથી ☐ પછી નક્કી કરીશું
મિલકત વીમો: ☐ ઈચ્છુક ☐ ઈચ્છુક નથી ☐ પછી નક્કી કરીશું

અથવા

અન્ય રીટેલ સંપત્તિ ઉત્પાદનો માટે (પીએલ/બીઆઈએલ વગેરે): ☐ હું/અમે આરબીએલ બેંક દ્વારા આપવામાં આવતો ઈન્થોરન્સ લેવા ઈચ્છું છું/ઈચ્છીએ છીએ ☐ ના, ઈન્થોરન્સની ખરીદી માટે મારી સંમતિ નથી.

કંપનીનું ખાતું ખોલવા માટે, નીચેના પ્રત્યેક દસ્તાવેજની પ્રમાણિત નકલો અથવા સમાન ઈ-દસ્તાવેજો આથી પ્રાપ્ત કરવામાં આવશે.

☐ વરિષ્ઠ મેનેજમેન્ટ હોદ્દો ધરાવતી સંબંધિત વ્યક્તિઓના નામ; અને

☐ રજીસ્ટર્ડ ઓફિસ અને વેપારનું મુખ્ય સ્થળ, જો તે અલગ હોય.

ભાગીદારી પેઢીનું ખાતું ખોલવા માટે, નીચેના પ્રત્યેક દસ્તાવેજની પ્રમાણિત નકલો અથવા સમાન ઈ-દસ્તાવેજો આથી પ્રાપ્ત કરવામાં આવશે:

☐ તમામ ભાગીદારોના નામ અને ☐ રજીસ્ટર્ડ ઓફિસનું સરનામું અને વેપારના મુખ્ય સ્થળનું સરનામું, જો તે અલગ હોય.

• જ્યાં ગ્રાહક એક કંપની હોય ત્યાં, લાભાર્થી માલિક કુદરતી વ્યક્તિ(ઓ) છે, જેઓ, એકલા કે સાથે કામ કરીને, અથવા એક અથવા વધુ ન્યાયિક વ્યક્તિઓ દ્વારા, અંકુશકારી માલિકી હિત ધરાવે છે અથવા અન્ય પદ્ધતિઓથી અંકુશ ધરાવે છે.

સમજૂતી - આ પેટા કલમ-4ના હેતુ માટે “અંકુશકારી માલિકી હિત”નો અર્થ છે કંપનીના શેર અથવા કેપિટલ અથવા નફામાં 10 ટકાથી વધુની માલિકી/અધિકાર, તમામ ભાગીદારોના નામ અને

• જ્યાં ગ્રાહક એક ટ્રસ્ટ છે, ત્યાં લાભાર્થી માલિક(માલિકો)ની ઓળખમાં સમાવિષ્ટ છે ટ્રસ્ટના ઓથરની ઓળખ, ટ્રસ્ટમાં 10 ટકા કે તેથી વધુ હિત ધરાવતા લાભાર્થીઓની ઓળખ અને અન્ય કોઈપણ કુદરતી વ્યક્તિ જે અંકુશ અને માલિકીની શ્રેણી દ્વારા ટ્રસ્ટ પર અંતિમ અસરકારક નિયંત્રણ ધરાવતા હોય.

• લાભાર્થી માલિક(બેનિફિશીયલ ઓનર - બીઓ)

જ્યાં ગ્રાહક એક ભાગીદારી પેઢી હોય ત્યાં લાભાર્થી માલિક કુદરતી વ્યક્તિ(ઓ) છે, જેઓ, એકલા કે સાથે કામ કરીને, અથવા એક અથવા વધુ ન્યાયિક વ્યક્તિઓ દ્વારા, ભાગીદારીના કેપિટલ અથવા નફામાં 10 ટકાથી વધુ માલિકી/અધિકાર ધરાવે છે અથવા જે અન્ય માધ્યમો દ્વારા નિયંત્રણ ધરાવે છે.

સમજૂતી - આ પેટા કલમના હેતુ માટે “નિયંત્રણ”માં મેનેજમેન્ટ અથવા નીતિસંબંધિત નિર્ણય પર નિયંત્રણના અધિકારનો સમાવેશ થાય છે.

ઈ. બેંક/અન્ય કોઈપણ બેંકના ડિરેક્ટર/વરિષ્ઠ અધિકારી સાથે સંબંધના સંદર્ભમાં ગ્રાહકની ઘોષણા

આઈ. હું આરબીએલ બેંકનો ડિરેક્ટર છું ☐ હા ☐ ના

II. હું અન્ય કોઈ બેંકનો ડિરેક્ટર છું * ☐ હા ☐ ના બેંકનું નામ: _____

III. હું આરબીએલ બેંકનો વરિષ્ઠ અધિકારી છું ☐ હા ☐ ના

IV. હું/અમે આરબીએલ બેંક/અન્ય બેંકના ડિરેક્ટર*/આરબીએલ બેંકના વરિષ્ઠ અધિકારીના સ્વજન છું/સ્વજન છીએ ☐ હા ☐ ના

V. અમે એક એકમ છીએ** જેમાં આરબીએલ બેંકના ડિરેક્ટર/ડિરેક્ટરના સ્વજન/વરિષ્ઠ અધિકારીના સ્વજન ડિરેક્ટર/ભાગીદાર/ગેરંટર/રસ ધરાવતી પાર્ટી**/કર્મચારી છે અથવા સબસિડીઅરી/હોલિંગ કંપની(લેણદાર કંપનીની) છીએ જેમાં આરબીએલ બેંકના ડિરેક્ટર, ડિરેક્ટર/મેનેજીંગ એજન્ટ/મેનેજર/કર્મચારી/ગેરંટર/નોંધપાત્ર હિત ધરાવે છે ☐ હા ☐ ના

vi. હું એક પેઢી/કંપનીમાં ભાગીદાર/ડિરેક્ટર છું જેમાં આરબીએલ બેંકના ડિરેક્ટર પણ ભાગીદાર/ડિરેક્ટર છે અથવા જો આરબીએલ બેંકના ડિરેક્ટર મારી કોઈપણ કેડિટ સુવિધાના ગેરંટર છે ☐ હા ☐ ના

*શેડ્યુલ્ડ કો-ઓપરેટીવ બેંકના ડિરેક્ટર, સબસિડીઅરીના ડિરેક્ટર/મ્યુચ્યુઅલ ફંડ/વેન્યર કેપિટલ ફંડસના ટ્રસ્ટીઓ સહિત.

**એકમમાં સામેલ છે પેઢી/કંપની, ડિરેક્ટર શબ્દમાં સામેલ છે આરબીએલ બેંક/અન્ય કોઈ બેંકના ડિરેક્ટર* રસ ધરાવતી પાર્ટીઓમાં સામેલ છે નોંધપાત્ર હિત ધરાવતી વ્યક્તિ જે/પ્રમુખ શેરધારક/મેનેજર/મેનેજીંગ એજન્ટ/અંકુશ ધરાવે છે.

જો હા, તો નીચે વિગતો જણાવો: હું ઘોષણા કરું છું કે હું આરબીએલ બેંક અથવા અન્ય કોઈપણ બેંકના ડિરેક્ટર(ડિરેક્ટરો) અને/અથવા વરિષ્ઠ અધિકારી(ઓ)નો સ્વજન છઉં જેની અહીં નિયત કરે છે

ક્રમાંક નં.	ડિરેક્ટર(ડિરેક્ટરો)/વરિષ્ઠ અધિકારી(ઓ)નું નામ	હોદ્દો	સંબંધ

#ઘોષણા અને મંજૂરી: મારા/અમારા દ્વારા આરબીએલ બેંક કેડિટ કાર્ડ, પર્સનલ લોન અને અન્ય કેડિટ સુવિધાઓ સંબંધિત ઓફર્સ માટે સંમતિ આપવાનું મંજૂર કરવામાં આવે છે. સંમતિ આપવા પર, મારા/અમારા દ્વારા આરબીએલ બેંકને મારી અરજીની વિગતો અને બીડલ કેવાયસી દસ્તાવેજો શેર કરવાની અને મારા કેડિટ કાર્ડ/લોન અરજી માટે તેનો ઉપયોગ કરવાની અધિકૃતતા આપવામાં આવે છે. મારા/અમારા દ્વારા પર ઉપલબ્ધ કેડિટ લાક્ષણિકતાઓ અને સૌથી મહત્વપૂર્ણ નિયમો અને શરતો (મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ એન્ડ કંડીશન્સ-એમઆઈટીસી)ને વાંચવામાં અને સમજવામાં આવ્યા છે.

નોંધ: કેડિટ કાર્ડ અને/અથવા અન્ય કેડિટ સુવિધાઓની મંજૂરી આરબીએલની મુનસફીને આધીન છે.

હું કેડિટ કાર્ડ માટે અરજી કરવા ઈચ્છું છું* ☐

હું કેડિટ કાર્ડ માટે અરજી કરવા ઈચ્છું છું* ☐

હું કેડિટ કાર્ડ માટે અરજી કરવા ઈચ્છું છું* ☐

હું કેડિટ કાર્ડ માટે અરજી કરવા ઈચ્છું છું* ☐

	ચીપકાવો માલિક/મુખ્ય ભાગીદાર/ પ્રમોટર/ડિરેક્ટરનો તાજેતરનો ફોટો અને તેની પર સહી કરો	ચીપકાવો તાજેતરનો ફોટો માલિક/ મુખ્ય ભાગીદાર/ પ્રમોટર/ડિરેક્ટરનો અને તેની પર સહી કરો	ચીપકાવો તાજેતરનો ફોટો માલિક/ મુખ્ય ભાગીદાર/ પ્રમોટર/ડિરેક્ટરનો અને તેની ઉપર સહી કરો	ચીપકાવો તાજેતરનો ફોટો માલિક/ મુખ્ય ભાગીદાર/ પ્રમોટર/ડિરેક્ટરનો અને તેની ઉપર સહી કરો
અધિકૃત વ્યક્તિની સહી	અધિકૃત વ્યક્તિની સહી	અધિકૃત વ્યક્તિની સહી	અધિકૃત વ્યક્તિની સહી	અધિકૃત વ્યક્તિની સહી

*કૃપા કરીને નોંધવા વિનંતી કે ભાગીદારી પેઢી/કંપનીના કિસ્સામાં, આ અરજી પર સહી કરતા અરજદાર(અરજદારો) આપવામાં આવેલ અધિકૃતતા પત્ર/બોર્ડના ઠરાવ અનુસાર અધિકૃત દસ્તાક્ષરકર્તા(ઓ) હોવા જોઈએ.

ફક્ત બેંકના ઉપયોગ માટે - નો ચોર કસ્ટમર વિગતો (કેવાયસી)

1. દસ્તાવેજ _____ દસ્તાવેજ આઈડી નં. _____ ફાળવણીની તારીખ _____ સમાપ્તિ(એક્સપાયરી) તારીખ _____
2. દસ્તાવેજ _____ દસ્તાવેજ આઈડી નં. _____ ફાળવણીની તારીખ _____ સમાપ્તિ(એક્સપાયરી) તારીખ _____

હું શ્રી/કુ. _____ ને વ્યક્તિગત રીતે મળ્યો છું. અરજદાર/સહ-અરજદાર દ્વારા નીચે ટીક કર્યા અનુસારના કેવાયસી દસ્તાવેજો મને આપવામાં આવ્યા છે. હું મંજૂર કરું છું કે મેં અરજદાર/સહ-અરજદારના રહેઠાણ/ઓફિસના સરનામાની મુલાકાત લીધી છે અને અરજદાર/સહ-અરજદારની ઓળખ અને સરનામાની ખરાઈ કરી છે. મારી હાજરીમાં ફોર્મ ભરવામાં આવ્યું છે અને તેના પર સહી કરી છે. મારા દ્વારા અસલ દસ્તાવેજની ખરાઈ કરવામાં આવી છે.

બેંકના અધિકારી/ડીએસઈ/ડીએસએનું નામ _____		બેંકના અધિકારી/ડીએસઈ/ડીએસએની સહી _____		કર્મચારી આઈડી _____	
☐ સ્ટાફ સૂચક	☐ સ્ટાફ આઈડી _____ (ફક્ત આરબીએલ બેંક કર્મચારી માટે)	શાખા કોડ _____	બંધારણ _____	☐ વ્યક્તિગત	☐ પેન્શનધારી
☐ આરબીએલ સ્ટાફ		☐ એનઆરઆઈ		☐ એનઆરઆઈ	
☐ કોલ કરશે નહીં ગ્રાહકનો પ્રકાર		☐ વ્યક્તિગત	☐ એનઆરઆઈ	☐ એચએનઆઈ	☐ વરિષ્ઠ નાગરિક (સીનિયર સિટીઝન)
પ્રોમો કોડ _____		વોક-ઈન ગ્રાહક ☐ હા ☐ ના		_____	
_____		એલસી કોડ _____	(એલજી) કોડ _____	પ્રાથમિક રીલેશનશીપ મેનેજર આઈડી _____	
_____		સોસિંગ કોડ _____	લીડ જનરેટર _____	_____	
નબળો વર્ગ _____		☐ પીઈપી	☐ સીઆરપીઈપી	સંસ્થાનો બીએસઆર પ્રકાર _____	
_____		_____		_____	
વેપાર વિભાગ _____		એમઆઈએસ કોડ.1 _____	એમઆઈએસ કોડ.2 _____	એમઆઈએસ કોડ.3 _____	એમઆઈએસ કોડ.4 _____
_____		_____		જોખમનું વર્ગીકરણ: ☐ એલ ☐ એમ ☐ એચ	

બેંકના અધિકારીનું નામ _____ બેંકના અધિકારીની સહી _____ કર્મચારી આઈડી _____

ગ્રાહકના લેટર હેડ પર

તારીખ: _____

પ્રતિ
શાખા પ્રબંધક,

શાખા
આરબીએલ બેંક લિમિટેડ

સંદર્ભ: આરબીએલ બેંક લિમિટેડની _____ શાખા ખાતે _____ ખાતું ખોલવા વિશે

માનનીય સાહેબ,

આ મે. _____ નું ખાતું ખોલવાના સંબંધમાં છે જે _____ તરીકેનું બંધારણ ધરાવે છે. ઉપરોક્ત ખાતા માટે અમે નીચે મુજબ ડિરેક્ટરો/ભાગીદારો/વરિષ્ઠ મેનેજમેન્ટ*/ડ્રસ્ટી/ઓથર/સેટલર/રક્ષક(જો કોઈ હોય તો)/લાભાર્થીઓની યાદી મંજૂર કરવા ઇચ્છીએ છીએ:

ક્રમાંક #	નામ	સંબંધ (દા.ત. ડિરેક્ટર/ભાગીદાર/વરિષ્ઠ મેનેજમેન્ટની વ્યક્તિ*/ડ્રસ્ટી, ઓથર, સેટલર, રક્ષક(જો કોઈ હોય તો), ડ્રસ્ટના લાભાર્થી)	હોદ્દો (જો કોઈ હોય તો)

સાદર
ગ્રાહકનું નામ અને સીલ

નોંધ: ઉપરોક્ત કોષ્ટકમાં સંસ્થાના બંધારણ અનુસાર નીચેની વિગતો હેવી જરૂરી છે

- પ્રાઈવેટ/પબ્લિક લિમિટેડ કંપની / વન પર્સન કંપની(ઓપીસી): કંપનીના સંબંધમાં, વરિષ્ઠ મેનેજમેન્ટ* અને ડિરેક્ટરોના નામ ફરજીયાત છે.
- ભાગીદારી પેઢી/લિમિટેડ લાભેબિલીટી ભાગીદારી: ભાગીદારોની યાદી ફરજીયાત છે.
- ડ્રસ્ટ, લાભાર્થીઓના, ડ્રસ્ટી, સેટલર, પ્રોટેક્ટર(જો કોઈ હોય તો), અને ડ્રસ્ટના ઓથરના નામ જરૂરી છે.

* વરિષ્ઠ મેનેજમેન્ટમાં સર્વોચ્ચ એક્ઝીક્યુટીવ મેનેજમેન્ટ/ઉચ્ચ મેનેજમેન્ટ દા.ત. એવા વ્યક્તિઓ જે સંસ્થાના મેનેજમેન્ટમાં ટોચના હોદ્દા પર બિરાજમાન હોય અને જેઓ પાસે સંસ્થાને સંભાળવા માટે રોજરોજની જવાબદારી હોય તેવી વ્યક્તિનો સમાવેશ થાય છે.

સૌથી મહત્વપૂર્ણ નિયમો અને શરતો

બિઝનેસ લોન અને લઘુ બિઝનેસ લોન	ફી અને ચાર્જ
પ્રોસેસિંગ ફી	બિઝનેસ લોન માટે લોનની રકમના 3% (રૂ. 15 લાખથી વધુની લોનની રકમ માટે) લઘુ વેપાર લોન માટે લોનની રકમના 3.5% (રૂ. 5 લાખથી રૂ. 15 લાખ) (રૂ. 5 લાખથી ઓછાની લઘુ વેપાર લોન પર કોઈ પ્રોસેસિંગ ફી લાગુ પાત્ર નથી)
ઈએમઆઈ ઓવરડ્યુ ચાર્જ	ઈએમઆઈની રકમના 2%
ખાતાનું ફિઝીકલ સ્ટેટમેન્ટ	ઘટનાદીઠ રૂ. 250
ભૌતિક પુનઃચક્રવણી સમયપત્રક	ઘટનાદીઠ રૂ. 250
ડ્રિપ્લિકેટ વ્યાજ અને પ્રિન્સીપાલ સર્ટિફિકેટની ફાળવણી	ઘટનાદીઠ રૂ. 250
ડ્રિપ્લિકેટ નો ડ્યુ સર્ટિફિકેટ/એનઓસી	ઘટનાદીઠ રૂ. 250
ચેક વિનિમય ચાર્જ	ઘટનાદીઠ રૂ. 500
ચેક/ઈસીએસ/એનએસીએચ અસ્વીકાર ચાર્જ	ઘટનાદીઠ રૂ. 500
સિબીલ રિપોર્ટ માટે ચાર્જ	રિપોર્ટ દીઠ રૂ. 100
જ્યાં પુનઃચક્રવણી પોતાના જ ફંડમાંથી કરવામાં આવી હોય ત્યાં સુધ્ધ અને લઘુ ઉદ્યોગો માટે પુનઃચક્રવણી ચાર્જ	શૂન્ય
જ્યાં કોઈ નાણાકીય સંસ્થા દ્વારા ટેકઓવર દ્વારા પુનઃચક્રવણી કરવામાં આવી હોય ત્યાં સુધ્ધ અને લઘુ ઉદ્યોગો માટે પુનઃચક્રવણી ચાર્જ	પુનઃચક્રવણીની/પ્રિન્સીપાલ આઉટસ્ટેન્ડિંગ રકમના 3%
અન્ય તમામ ગ્રાહકો માટે પુનઃચક્રવણી ચાર્જ	ચક્રવેલા પ્રથમ 18 ઈએમઆઈનીની ચક્રવણી સુધી - પ્રિન્સીપાલ આઉટસ્ટેન્ડિંગના 5% \ 18થી વધુ ચક્રવેલ ઈએમઆઈ માટે - પ્રિન્સીપાલ આઉટસ્ટેન્ડિંગના 3%
દસ્તાવેજીકરણ ચાર્જ	રૂ. 5 લાખથી ઓછી લઘુ વેપાર લોન માટે રૂ. 7000
લોન કેન્સલેશન ચાર્જ	રૂ. 3000/- + કેન્સલેશન તારીખ સુધી ચાર્જ કરવામાં આવેલ વ્યાજ
કાનૂની, પુનઃમાલિકી અને આનુષંગિક ચાર્જ	વાસ્તવિક પર
ફિલ્ડ કલેક્શન ચાર્જ	ઘટનાદીઠ રૂ. 500

ઉપરોક્ત ચાર્જ બાદ અને ઉપર પ્રવર્તમાન દર અનુસાર લાગુ પાત્ર ટેક્સ અને અન્ય સરકારી ટેક્સ, લેવી વગેરે ચાર્જ કરવામાં આવશે. અહીં દર્શાવેલ દર, ફી, ચાર્જ વગેરે સમયે સમયે બદલાવ/સુધારાને આધીન છે. અદ્યતન ચાર્જ માટે, અમારી વેબસાઇટ www.rblbank.com જુઓ અથવા આરબીએલ બેંકના પ્રતિનિધિનો સંપર્ક કરો.

\$ લોનની ક્લોઝર વિનંતીઓ માટે ફંડના સ્ત્રોતના દસ્તાવેજ પુરાવા વિશે પૂછપરછ કરવાનો અને પૂછવાનો અધિકાર બેંક ધરાવે છે.

રેટ ઓફ ઇન્ટરેસ્ટ(આરઓઆઈ): અવધિ, ઉત્પાદનની શ્રેણી સહિત ગ્રાહકના રીસ્ક પ્રોફાઇલિંગ, ક્રેડિટ બ્યૂરો સ્કોર ઉમેરીને લાગુ પાત્ર આરઓઆઈ નક્કી કરવામાં આવશે.

એસએમએ/એનપીએ વર્ગીકરણ:

દેણદારના ખાતાઓનું એસએમએ/એનપીએ તરીકેનું વર્ગીકરણ સંબંધિત તારીખ માટે દિવસના અંતની કાર્યવાહીના ભાગ રૂપે થવું જોઈએ. એસએમએ/એનપીએની તારીખ જે તે કેલેન્ડર તારીખે દિવસના અંતે ખાતા પર એસેટ વર્ગીકરણની સ્થિતિ પ્રદર્શિત કરશે.

એસએમએ/એનપીએ શ્રેણીઓ	વર્ગીકરણનો આધાર - પ્રિન્સીપાલ અથવા વ્યાજની ચક્રવણી અથવા અન્ય કોઈ રકમ સંપૂર્ણ અથવા અંશતઃ ઓવરડ્યુ.
એસએમએ - 0	30 દિવસ સુધી
એસએમએ-1	30 દિવસથી વધુ અને 60 દિવસ સુધી
એસએમએ-2	60 દિવસથી વધુ અને 90 દિવસ સુધી
એનપીએ	90 દિવસથી વધુ

ઉદાહરણ: જો લોન ખાતાની ડ્યુ તારીખ માર્ચ 31, 2021 હોય, અને આ તારીખ પહેલાં સંપૂર્ણ બાકી રકમ પ્રાપ્ત ન થઈ હોય તો, ઓવરડ્યુની તારીખ માર્ચ 31, 2021 ગણાશે. જો ખાતું મુદતવીતી તરીકે ચાલુ જ રહે છે, તો આ ખાતું એપ્રિલ 30, 2021ના રોજ એટલે કે મુદતવીતી તરીકે સંતૃપ્ત 30 દિવસ રહેવા પર દિવસના અંતની પ્રક્રિયા હાથ ધરાવામાં આવતાં એસએમએ-1 તરીકે વર્ગીકૃત થશે. તે મુજબ, આ ખાતા માટે એસએમએ-1 વર્ગીકરણની તારીખ એપ્રિલ 30, 2021 થઈ જશે. એજ રીતે, જો ખાતું ઓવરડ્યુ રહેવાનું ચાલુ રહે તો, મે 30, 2021ના રોજ તે એસએમએ-2 તરીકે ગણાશે અને જો વધુ ઓવરડ્યુ રહેવાનું ચાલુ રહે તો, જૂન 29, 2021ના રોજ તેને એનપીએ તરીકે વર્ગીકૃત કરવામાં આવશે.

દસ્તાવેજ તપાસયાદી

પૂર્વ-મંજૂરી દસ્તાવેજો

- પેઢી અને પ્રમોટરોની માહિતી
- છેલ્લાં 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ
- સમયપત્રક, ખાતાને નોંધ, અને ઓડિટ રિપોર્ટ સાથે છેલ્લાં 2 વર્ષનું ઓડિટ કરેલ નાણાકીય સ્ટેટમેન્ટ..
- તમામ સંબંધિત એનેક્સર સાથે છેલ્લાં 2 વર્ષનું આઈટીઆર
- કંપની અને ડિરેક્ટરોની માહિતી
- કંપનીના બંધારણ દસ્તાવેજો દા.ત. મેમોરેન્ડમ અને એસોસિયેશનના આર્ટીકલ
- બોર્ડના ઠરાવની પ્રમાણિત નકલ(કંપની અરજદાર હોવાના કિસ્સામાં)
- ધરની/ઓફિસની માલિકીનો પુરાવો (વીજળીનું બિલ/ટેલિફોન બિલ/હાઉસિંગ સોસાયટી/લીઝ એગ્રીમેન્ટ/સેલ ડીડ દ્વારા એલોટેમેન્ટ પત્ર)
- બિઝનેસ લોન લેવાના હેતુ/અંતિમ વપરાશ દર્શાવતો પત્ર
- કોઈપણ વર્તમાન બેંકિંગ સુવિધાનો મંજૂરી પત્ર અને ખાતાનું સ્ટેટમેન્ટ
- માલિક/તમામ ભાગીદાર/ડિરેક્ટરોની ઓળખનો અને સરનામાનો પુરાવો: પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર નંબર હોવાનો પુરાવો, મતદાર ઓળખપત્ર, નરેગા જોબ કાર્ડ, રાષ્ટ્રીય વસ્તીગણતરી પત્રક દ્વારા ફાળવવામાં આવેલ પત્ર.
- પેઢીના સરનામાનો પુરાવો
- બિઝનેસ ચાલુ રહેવાનો/જૂનો હોવાનો પુરાવો
- પેઢીની નોંધણીનું સર્ટિફિકેટ(જો નોંધાયેલ હોય તો)/પાઈનરશીપ ડીડ
- એસએસઆઈ રજીસ્ટ્રેશન, જો લાગુ હોય તો વીએટી મલ્ટ્યાંકન ઓર્ડર અથવા સેલ્સ ટેક્સ રજીસ્ટ્રેશન અથવા શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ અંતર્ગત ફાળવવામાં આવેલ લાયસન્સ અથવા સીએસટી/વીએટી સર્ટિફિકેટ.
- કેસ અનુસાર આવશ્યક અન્ય કોઈ દસ્તાવેજ/જાણકારી.

મંજૂરી બાદના દસ્તાવેજો

- લોન એગ્રીમેન્ટ પુસ્તિકા અને અન્ય દસ્તાવેજો કીટમાં બીડેલ નથી
- એનએસીએચ/ઈસીએસ/એસઆઈ/સિક્યોરીટી ચેક

સૌથી મહત્વપૂર્ણ નિયમો અને શરતો

બિઝનેસ લોન અને લઘુ બિઝનેસ લોન	ફી અને ચાર્જ
પ્રોસેસિંગ ફી	બિઝનેસ લોન માટે લોનની રકમના 3% (રૂ. 15 લાખથી વધુની લોનની રકમ માટે) લઘુ વેપાર લોન માટે લોનની રકમના 3.5% (રૂ. 5 લાખથી રૂ. 15 લાખ) (રૂ. 5 લાખથી ઓછાની લઘુ વેપાર લોન પર કોઈ પ્રોસેસિંગ ફી લાગુ પાત્ર નથી)
ઈએમઆઈ ઓવરડ્યુ ચાર્જ	ઈએમઆઈની રકમના 2%
ખાતાનું ફિઝીકલ સ્ટેટમેન્ટ	ઘટનાદીઠ રૂ. 250
ભૌતિક પુનઃચક્રવણી સમયપત્રક	ઘટનાદીઠ રૂ. 250
ડ્રિપ્લિકેટ વ્યાજ અને પ્રિન્સીપાલ સર્ટિફિકેટની ફાળવણી	ઘટનાદીઠ રૂ. 250
ડ્રિપ્લિકેટ નો ડ્યુ સર્ટિફિકેટ/એનઓસી	ઘટનાદીઠ રૂ. 250
ચેક વિનિમય ચાર્જ	ઘટનાદીઠ રૂ. 500
ચેક/ઈસીએસ/એનએસીએચ અસ્વીકાર ચાર્જ	ઘટનાદીઠ રૂ. 500
સિબીલ રિપોર્ટ માટે ચાર્જ	રિપોર્ટ દીઠ રૂ. 100
જ્યાં પુનઃચક્રવણી પોતાના જ ફંડમાંથી કરવામાં આવી હોય ત્યાં સુધ્ધ અને લઘુ ઉદ્યોગો માટે પુનઃચક્રવણી ચાર્જ	શૂન્ય
જ્યાં કોઈ નાણાકીય સંસ્થા દ્વારા ટેકઓવર દ્વારા પુનઃચક્રવણી કરવામાં આવી હોય ત્યાં સુધ્ધ અને લઘુ ઉદ્યોગો માટે પુનઃચક્રવણી ચાર્જ	પુનઃચક્રવણીની/પ્રિન્સીપાલ આઉટસ્ટેન્ડિંગ રકમના 3%
અન્ય તમામ ગ્રાહકો માટે પુનઃચક્રવણી ચાર્જ	ચક્રવેલા પ્રથમ 18 ઈએમઆઈનીની ચક્રવણી સુધી - પ્રિન્સીપાલ આઉટસ્ટેન્ડિંગના 5% \ 18થી વધુ ચક્રવેલ ઈએમઆઈ માટે - પ્રિન્સીપાલ આઉટસ્ટેન્ડિંગના 3%
દસ્તાવેજીકરણ ચાર્જ	રૂ. 5 લાખથી ઓછી લઘુ વેપાર લોન માટે રૂ. 7000
લોન કેન્સલેશન ચાર્જ	રૂ. 3000/- + કેન્સલેશન તારીખ સુધી ચાર્જ કરવામાં આવેલ વ્યાજ
કાનૂની, પુનઃમાલિકી અને આનુષંગિક ચાર્જ	વાસ્તવિક પર
ફિલ્ડ કલેક્શન ચાર્જ	ઘટનાદીઠ રૂ. 500

ઉપરોક્ત ચાર્જ બાદ અને ઉપર પ્રવર્તમાન દર અનુસાર લાગુ પાત્ર ટેક્સ અને અન્ય સરકારી ટેક્સ, લેવી વગેરે ચાર્જ કરવામાં આવશે. અહીં દર્શાવેલ દર, ફી, ચાર્જ વગેરે સમયે સમયે બદલાવ/સુધારાને આધીન છે. અદ્યતન ચાર્જ માટે, અમારી વેબસાઇટ www.rblbank.com જુઓ અથવા આરબીએલ બેંકના પ્રતિનિધિનો સંપર્ક કરો.

\$ લોનની ક્લોઝર વિનંતીઓ માટે ફંડના સ્ત્રોતના દસ્તાવેજ પુરાવા વિશે પૂછપરછ કરવાનો અને પૂછવાનો અધિકાર બેંક ધરાવે છે.

રેટ ઓફ ઇન્ટરેસ્ટ(આરઓઆઈ): અવધિ, ઉત્પાદનની શ્રેણી સહિત ગ્રાહકના રીસ્ક પ્રોફાઇલિંગ, ક્રેડિટ બ્યૂરો સ્કોર ઉમેરીને લાગુ પાત્ર આરઓઆઈ નક્કી કરવામાં આવશે.

એસએમએ/એનપીએ વર્ગીકરણ:

દેણદારના ખાતાઓનું એસએમએ/એનપીએ તરીકેનું વર્ગીકરણ સંબંધિત તારીખ માટે દિવસના અંતની કાર્યવાહીના ભાગ રૂપે થવું જોઈએ. એસએમએ/એનપીએની તારીખ જે તે કેલેન્ડર તારીખે દિવસના અંતે ખાતા પર એસેટ વર્ગીકરણની સ્થિતિ પ્રદર્શિત કરશે.

એસએમએ/એનપીએ શ્રેણીઓ	વર્ગીકરણનો આધાર - પ્રિન્સીપાલ અથવા વ્યાજની ચક્રવણી અથવા અન્ય કોઈ રકમ સંપૂર્ણ અથવા અંશતઃ ઓવરડ્યુ.
એસએમએ - 0	30 દિવસ સુધી
એસએમએ-1	30 દિવસથી વધુ અને 60 દિવસ સુધી
એસએમએ-2	60 દિવસથી વધુ અને 90 દિવસ સુધી
એનપીએ	90 દિવસથી વધુ

ઉદાહરણ: જો લોન ખાતાની ડ્યુ તારીખ માર્ચ 31, 2021 હોય, અને આ તારીખ પહેલાં સંપૂર્ણ બાકી રકમ પ્રાપ્ત ન થઈ હોય તો, ઓવરડ્યુની તારીખ માર્ચ 31, 2021 ગણાશે. જો ખાતું મુદતવીતી તરીકે ચાલુ જ રહે છે, તો આ ખાતું એપ્રિલ 30, 2021ના રોજ એટલે કે મુદતવીતી તરીકે સંતૃપ્ત 30 દિવસ રહેવા પર દિવસના અંતની પ્રક્રિયા હાથ ધરાવામાં આવતાં એસએમએ-1 તરીકે વર્ગીકૃત થશે. તે મુજબ, આ ખાતા માટે એસએમએ-1 વર્ગીકરણની તારીખ એપ્રિલ 30, 2021 થઈ જશે. એજ રીતે, જો ખાતું ઓવરડ્યુ રહેવાનું ચાલુ રહે તો, મે 30, 2021ના રોજ તે એસએમએ-2 તરીકે ગણાશે અને જો વધુ ઓવરડ્યુ રહેવાનું ચાલુ રહે તો, જૂન 29, 2021ના રોજ તેને એનપીએ તરીકે વર્ગીકૃત કરવામાં આવશે.

દસ્તાવેજ તપાસયાદી

પૂર્વ-મંજૂરી દસ્તાવેજો

- પેઢી અને પ્રમોટરોની માહિતી
- છેલ્લાં 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ
- સમયપત્રક, ખાતાને નોંધ, અને ઓડિટ રિપોર્ટ સાથે છેલ્લાં 2 વર્ષનું ઓડિટ કરેલ નાણાકીય સ્ટેટમેન્ટ..
- તમામ સંબંધિત એનેક્સર સાથે છેલ્લાં 2 વર્ષનું આઈટીઆર
- કંપની અને ડિરેક્ટરોની માહિતી
- કંપનીના બંધારણ દસ્તાવેજો દા.ત. મેમોરેન્ડમ અને એસોસિયેશનના આર્ટીકલ
- બોર્ડના ઠરાવની પ્રમાણિત નકલ(કંપની અરજદાર હોવાના કિસ્સામાં)
- ધરની/ઓફિસની માલિકીનો પુરાવો (વીજળીનું બિલ/ટેલિફોન બિલ/હાઉસિંગ સોસાયટી/લીઝ એગ્રીમેન્ટ/સેલ ડીડ દ્વારા એલોટેમેન્ટ પત્ર)
- બિઝનેસ લોન લેવાના હેતુ/અંતિમ વપરાશ દર્શાવતો પત્ર
- કોઈપણ વર્તમાન બેંકિંગ સુવિધાનો મંજૂરી પત્ર અને ખાતાનું સ્ટેટમેન્ટ
- માલિક/તમામ ભાગીદાર/ડિરેક્ટરોની ઓળખનો અને સરનામાનો પુરાવો: પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર નંબર હોવાનો પુરાવો, મતદાર ઓળખપત્ર, નરેગા જોબ કાર્ડ, રાષ્ટ્રીય વસ્તીગણતરી પત્રક દ્વારા ફાળવવામાં આવેલ પત્ર.
- પેઢીના સરનામાનો પુરાવો
- બિઝનેસ ચાલુ રહેવાનો/જૂનો હોવાનો પુરાવો
- પેઢીની નોંધણીનું સર્ટિફિકેટ(જો નોંધાયેલ હોય તો)/પાઈનરશીપ ડીડ
- એસએસઆઈ રજીસ્ટ્રેશન, જો લાગુ હોય તો વીએટી મલ્ટ્યાંકન ઓર્ડર અથવા સેલ્સ ટેક્સ રજીસ્ટ્રેશન અથવા શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ અંતર્ગત ફાળવવામાં આવેલ લાયસન્સ અથવા સીએસટી/વીએટી સર્ટિફિકેટ.
- કેસ અનુસાર આવશ્યક અન્ય કોઈ દસ્તાવેજ/જાણકારી.

મંજૂરી બાદના દસ્તાવેજો

- લોન એગ્રીમેન્ટ પુસ્તિકા અને અન્ય દસ્તાવેજો કીટમાં બીડેલ નથી
- એનએસીએચ/ઈસીએસ/એસઆઈ/સિક્યોરીટી ચેક

